



પ્રજ્ઞા અભિગમ અંતર્ગત

પૂરક વાચન સાહિત્ય

માઈલસ્ટોન - ૧ થી ૪

(પુનરાવર્તન)

નિર્માણ

રાજેશકુમાર એસ. પટેલ

ડીસ્ટ્રીક્ટ પેડાગોજી કો ઓર્ડીનેટર

સર્વ શિક્ષા અભિયાન, આણંદ

**Lots of Information About
Primary Education – Visit this Site**

www.pgondaliya.com

Puran Gondaliya - Porbandar

ਕਰ

ਕਸ

ਅਤ

ਯਮ

ਠਸ

ਰਸ

ਸਮ

ਨਮ

ਘਸ

ਵਰ

ਪ੍ਰਭ

ਮਨ

ਭ੍ਰਿਭ

ਭ੍ਰਿਭ

ਫਮ

ਮਭ

ਰਮ

ਪਤ

ਫਰ

ਫਿਸ

ਮਗਰ

ਫਰਫ

ਯਮਲਾ

ਕਮਰ

ਅਯਯ

ਗਰਮ

ਸਰਸ

ਵਯਨ

ਨਮਨ

ਯਗਨ

ਨਾਮ

ਪਾਤ

ਗਾਮ

ਕਾਮ

ਗਾਯ

ਫਾਯ

ਮਾਗ

ਆਪ

ਵਾਰ

ਨਾਕ

સાલ

વાસ

સાત

બાગ

સાદ

સાપ

જાગ

વાલ

રાબ

આજ

મજા

રાજા

રજા

મામા

કરા

કાકા

જરા

બાપા

વડા

માસા

સગા

સારા

નાના

સાદા

ખાટા

મારા

બાવા

જાડા

પાસા

આડા

ਰਾਖੀ

ਗਾਡੀ

ਮਾਸੀ

ਨਾਡੀ

ਮਾਮੀ

ਸਾਡੀ

ਕਾਕੀ

ਵਾਡੀ

ਠਾਠੀ

ਠਾਠੀ

ਰਾਜੀ

ੳਤੀ

ਪਾੳੀ

ਕਤੀ

ਮਾਜੀ

ੲਤੀ

ਵਾੳੀ

ਪਤੀ

ਸਾਰੀ

ੲਤੀ

ਐਕ

ਅਤੇ

ਸੇਵ

ਯਮੇ

ਵੇਦ

ਰਤੇ

ਤੇਰ

ਰਮੇ

ਏਕ

ਪਤੇ

જાણો

પાડો

આજો

આપો

કાલો

કાપો

પાસો

માગો

તાણો

સામો

આ મારા દાદા છે.

દાદા મને ગમે છે.

દાદા મને રેવડી આપે છે.

દાદા મને રમાડે છે.

દાદા મને ગમે છે.

રમા, કાપડ કાપ.

મીતા, બરણી આપ.

બા, મગસ બનાવ.

અમર, દવા પી.

જમ. ગરમ જમ. કાનજી, ગરમ જમ.	રમ. રમત રમ. તારા, રમત રમ.
જા. ગામ જા. ગીતા, ગામ જા.	કર. કામ કર. જાનકી, કામ કર.
માગ. મમરા માગ. મીના, મમરા માગ.	જાગ. તરત જાગ. પરાગ, તરત જાગ.
આવજે. મારા બાગમાં આવજે.	સાદ પાડ. મગન સાદ પાડ.
પેન આપ. બે પેન આપ.	વાડીએ જા. મામાની વાડીએ જા.
કેરી કાપ. પાકી કેરી કાપ.	મજા પડી. રમવાની મજા પડી.

